



### સીટી ઓફ બ્રેમ્પટન સીમિત પ્રવેશ અને સંચાલન ક્લાકો સાથે બ્રેમ્પટન સેમિટરી ફરીથી ખોલશે

બ્રેમ્પટન, ઓન્ટેરિયો (મે 7, 2020) – શનિવાર, મે 9, 2020 થી અમલમાં આવે તે રીતે, તમામ મુલાકાતીઓ અને કર્મચારીગણની સુરક્ષાની ખાતરી કરવા, સીટી ઓફ બ્રેમ્પટન 10 વિલ્સન એવન્યુ સ્થિત બ્રેમ્પટન સેમિટરીને નિયંત્રિત, સીમિત પ્રવેશ સાથે ફરીથી ખોલશે.

સેમિટરીમાં પ્રવેશ ચર્ચ સ્ટ્રીટ પરના (બીચ સ્ટ્રીટથી સૌથી નજીકના) ગેટ સુધી સીમિત રાખવામાં આવશે.

આપણાં શહેરની 25 અગ્રણી સેમિટરીસ આગળ સૂચના આપવામાં ના આવે ત્યાં સુધી બંધ રહે છે.

બીરીવમેન્ટ ઓથોરિટી ઓફ ઓન્ટેરિયોએ નિર્ધારિત કરેલા નિર્દેશો અનુસાર, એક સમયે બ્રેમ્પટન સેમિટરીમાં મહત્તમ 10 લોકોને પ્રવેશવા દેવામાં આવશે જેમાં પ્લોટ દીઠ પાંચથી વધારે લોકો નહીં હોય. દરેક મુલાકાત 15 મિનિટ સુધી સીમિત રાખવામાં આવશે.

વધારે પ્રતિબંધો અમલમાં આવી શકે જો હાજર રહેતા કુટુંબીજનો એકબીજાને અડીને આવેલા પ્લોટસમાં ભેગા થવાના હોય. પરિણામ સ્વરૂપે, રહેવાસીઓને વધારે લાંબા સમય સુધી રાહ જોવાનું અનુભવવું પડે તેવું બની શકે.

વ્યક્તિઓ વચ્ચે શારીરિક અંતર જાળવવાના નિયમનો સાથે સુસંગત રહેવાની ખાતરી કરવા, મુલાકાતીઓએ બધાં સમયે અન્ય લોકોથી (એક જ ઘરમાં ના રહેતા હોય તેવા લોકોથી) બે મીટર (છ ફૂટ) દૂર રહેવાનું ચાલુ રાખવું પડશે.

બ્રેમ્પટન સેમિટરીના સંચાલન ક્લાકો:

- શનિવાર, મે 9: સાંજે 5 – રાત્રે 8 વાગ્યા સુધી
- રવિવાર, મે 10: બંધ
- સોમવાર, મે 11 થી શરૂ કરીને: સોમવારથી શુક્રવાર, સાંજે 4:30 થી રાત્રે 7:30 વાગ્યા સુધી; શનિવારે અને રવિવારે, બપોરે 3 થી સાંજે 7:30 વાગ્યા સુધી

સુધારેલા સંચાલન ક્લાકોની સલાહ આપવા, બ્રેમ્પટન સેમિટરીની બહાર સાર્થન બોર્ડર્સ મૂકવામાં આવશે.

આવશ્યક સેવાઓ, જેમ કે દફનવિધિ-અંતિમવિધિ અને દફન માટેના પ્લોટની વેચાણ કામગીરી, માત્ર એપોઈન્ટમેન્ટથી પૂરું પાડવાનું ચાલુ છે. રહેવાસીઓને એપોઈન્ટમેન્ટ નોંધાવવા 905.874.2997 નંબર પર કોલ કરવાનું કહેવામાં આવે છે.

બ્રેમ્પટન સેમિટરી, તેમજ 25 અગ્રણી સેમિટરીસનું સંચાલન કરવા સીટી ઓફ બ્રેમ્પટન જવાબદાર છે. બ્રેમ્પટન સેમિટરીસની યાદી [અહીં ઉપલબ્ધ છે](#).

**અવતરણ (ક્વૉટ):**

“કુટુંબીજનો આ મધર્સ ડે પર પોતાના સ્વર્ગસ્થ માતા અને બા-દાદીને પોતાનો આદર આપી શકે તેનું મહત્વ અમે સમજીએ છીએ, અને સીટી માટે સેમિટરી બંધ કરવાનો નિર્ણય મુશ્કેલભર્યો હતો. સૌથી સુરક્ષિત સંભવિત રીતે આ મહત્વની સેવાઓ પૂરી પાડવા, સીટી આ શનિવારથી સીમિત પ્રવેશ અને સંચાલન ક્લાકોમાં બ્રેમ્પટન સેમિટરી ફરીથી ખોલી રહ્યું છે, પરંતુ રવિવારે મુલાકાતીઓ મોટી સંખ્યામાં આવે તેવી અપેક્ષા હોવાને લીધે તે બંધ રહેશે. અમે વ્યક્તિઓ વચ્ચે શારીરિક અંતર જાળવવાના પગલાઓ ભરીને અમારા મુલાકાતીઓ અને કર્મચારીગણનું આરોગ્ય



# BRAMPTON

## Service and Information Update

अने सुरक्षाने संरक्षण आपवानुं यावु राभवा ँरखीअे छीअे, परंतु आ समये आ सेवाओ सुधी पळोयवा ँरखता वोकोने टेको पाणु आपीअे छीअे.”

- पॅट्रिक ब्राउन (Patrick Brown), मेयर, सीटी ओफ़ ब्रॅम्पटन

-30-

### मिडिया संपर्क :

मोनिका दुग्गल

कोऑर्डिनेटर, मिडिया अँड कम्युनिटी अँगेजमेन्ट

व्यूडान्मक संवाद

सीटी ओफ़ ब्रॅम्पटन

905-874-3426 | [Monika.Duggal@brampton.ca](mailto:Monika.Duggal@brampton.ca)